

મુખ્ય હકીકતોનું નિવેદન

ભાગ 1 (વ્યાજ દર અને ફી / ચાર્જિસ)

તારીખ:

1	લોન દરખાસ્ત / એકાઉન્ટ નં.		લોનનો પ્રકાર		Gold Loan	
2	લોનની મંજૂર થયેલ રકમ (₹ માં)					
3	ચુકવણીનું સમયપત્રક (i) તબક્કામાં અથવા 100% અગાઉથી ચુકવણી. (ii) જો તે તબક્કાવાર હોય, તો સંબંધિત વિગતો ધરાવતી લોન કરારની કલમ જુઓ			100% upfront		
4	લોનની મુદત (વર્ષ/મહિના/દિવસો)			મહિના		
5	ચુકવણીનું શેડ્યૂલ					
	હપ્તો નંબર	ચુકવણીની તારીખ	પ્રારંભિક મુદ્દલ (₹ માં)	મુદ્દલની ચુકવણી (₹ માં)	વ્યાજ (₹ માં)	કુલ ચુકવણી (₹ માં)
	કુલ					
6	વ્યાજ દર (%) અને પ્રકાર (ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ અથવા હાઇબ્રિડ)			Fixed		
7	વ્યાજના ફ્લોટિંગ દરના કિસ્સામાં વધારાની માહિતી					
રેફરન્સ બેન્ચમાર્ક k	બેન્ચમાર્ક રેટ (%) (B)	સ્પ્રેડ (%) (S)	અંતિમ રેટ (%) $R = (B) + (S)$	રીસેટ કરો સામયિકતા ² (મહિના)		રેફરન્સ બેન્ચમાર્કમાં ફેરફારની અસર ('R' માં 25 bps ફેરફાર માટે, આમાં ફેરફાર કરો:3)
				B	S	
NA	NA	NA	NA	NA	NA	NA
8	ફી /ચાર્જિસ ⁴					
		RE (A) ને ચૂકવવાપાત્ર		RE (B) દ્વારા ત્રીજા પક્ષકારને ચૂકવવાપાત્ર		
		એક વખત / વારંવાર	રકમ (₹ માં) અથવા ટકા (%) લાગુ પડતું હોય તેમ ⁵	એક વખત / વારંવાર		લાગુ પડતી રકમ (₹ માં) અથવા ટકાવારી ⁵
(i)	પ્રોસેસીંગ ફી	One time				
(ii)	વીમા ચાર્જીસ	One time				
(iii)	મૂલ્યાંકન ફી	NA	NA			
(iv)	SMS ચાર્જ	માસિક	₹7 GST સહિત			
9	વાર્ષિક ટકાવારી દર (એપ્રિલ) (APR) (%) ⁶					

Signed by OTP ()



10	આકાસ્મિક ચાજીસની વિગતો (લાગુ પડતી હોય તમ ₹ અથવા %માં)		
(i)	વિલંબિત ચુકવણીના સંજોગોમાં દંડ, જો કોઈ હોય તો	3% દર મહિને	
(ii)	અન્ય દંડ ચાજીસ, જો કોઈ હોય તો	NA	
(iii)	પૂર્વચુકવણી દંડ / ફોરકલોજર ચાજીસ, જો લાગુ પડતા હોય તો	દિવસ	ટકાવારી
		0-5 દિવસો	2% + 18% GST
		6-10 દિવસો	1% + 18% GST
		>10 દિવસો	0%
(iv)	ફ્લોટિંગથી ફિક્સ્ડ રેટ અને તેનાથી વિપરીત લોનના સ્વિચિંગ માટેના ચાજીસ	NA	
(v)	MTM શુલ્ક	500	
(vi)	રોકડ હેન્ડલિંગ ચાર્જ	INR 25 અથવા GST સહિત રોકડ વ્યવહારના 0.25% (જે વધારે હોય તે)	
(vii)	પૂર્વ હરાજી શુલ્ક	200	
(viii)	હરાજી પછીના શુલ્ક	1500	
(ix)	લોન કાર્યકાળ વિસ્તરણ ચાર્જ	0.15% + 18% GST	
(x)	ભાગ રિલીઝ ચાર્જ	વિનંતી કરેલી લોનની રકમ	ચાર્જ
		₹2,00,000 થી ઓછો	₹150 + 18% GST
		₹2,00,001 થી ₹7,00,000 થી ઓછો	₹300 + 18% GST
		₹7,00,001 અને તેથી વધુ	₹500 + 18% GST
(xi)	SOA - ડિજિટલ નકલ	મફત	
(xii)	SOA - ભૌતિક નકલ	₹50 + 18% GST	

ભાગ 2 (અન્ય ગુણાત્મક માહિતી)

1	રિક્વેરી એજન્ટની નિમણૂક સંબંધિત લોન કરારમાં કલમ	related to	Under Clause no. 9.4 of Standard Terms & Condition
2	ફરિયાદ નિવારણ પદ્ધતિની વિગતો આપતા લોન કરારમાં કલમ	which details	Under Clause no. 9.14 of Standard Terms & Condition
3	નોડલ ફરિયાદ નિવારણ અધિકારીનો ફોન નંબર અને ઇમેઇલ આઈડી ⁷	of the nodal	Under Clause no. 9.14 of Standard Terms & Condition
4	શું લોન અન્ય નિયમનકારી સંસ્થાઓને અથવા ભવિષ્યમાં ટ્રાન્સફર કરી શકાય છે (હા/ના)		Under Clause no. 9.5 & 9.6 of Standard Terms & Condition
5	સહયોગી ધિરાણ વ્યવસ્થા હેઠળ ધિરાણના સંજોગોમાં (દા.ત., સહ-ધિરાણ/આઉટસોર્સિંગ), નીચેની વધારાની વિગતો આપવામાં આવી શકે છે:		
મૂળ RE નું નામ, તેમજ તેનો ભંડોળ ગુણોત્તર		ભાગીદાર RE નું નામ અને તેના ભંડોળનો ગુણોત્તર	મિશ્રિત વ્યાજ દર

Signed by OTP ()

ઉધાર લેનારની સહી



*CLM2 ના કિસ્સામાં, ભાગીદાર RE નું નામ ડિસ્બર્સમેન્ટ પછી એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં બતાવવામાં આવશે		
6	ડિજિટલ લોનના સંજોગોમાં, નીચેની ચોક્કસ જાહેરાતો રજૂ કરી શકાય છે:	
(i)	RE ની બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ મુજબ ફૂલીંગ ઓફ/લુક-અપ પોલિસી, જે દરમિયાન લોનની પૂર્વચુકવણી પર લોન લેનાર પાસેથી કોઈ દેડ વસૂલવામાં આવશે નહીં.	NA
(ii)	રિકવરી એજન્ટ તરીકે કામ કરતી અને ઉધાર લેનારાનો સંપર્ક કરવા માટે અધિકૃત LSPની વિગતો	NA

એપ્રિલ ગણતરીનું ઉદાહરણ

S No.	પરિમાણ	વિગતો
1	મંજૂર લોનની રકમ (રૂપિયામાં)	
2	લોનની મુદત	મહિના
(a)	બિન-સમાન સામયિક લોનના કિસ્સામાં, મુદ્દલની ચુકવણી માટેના હપ્તાઓની સંખ્યા	1
(b)	EPI નો પ્રકાર દરેક EPI ની રકમ (રૂપિયામાં) નંબર EPIs (દા.ત., માસિકના કિસ્સામાં EMIની સંખ્યા હપ્તાઓ)	NA
(c)	મૂડીકૃત વ્યાજની ચુકવણી માટેના હપ્તાની સંખ્યા, જો કોઈ હોય તો	NA
(d)	ચુકવણીની શરૂઆત, મંજૂરી પછી	
3	વ્યાજ દરનો પ્રકાર (નિશ્ચિત અથવા ફ્લોટિંગ અથવા અર્ધ-નિશ્ચિત)	
4	વ્યાજ દર	Fixed
5	સમગ્ર સમયગાળા દરમિયાન વસૂલવાની કુલ વ્યાજની રકમ પ્રવર્તમાન દર મુજબ લોનની મુદત મંજૂરીની તારીખ. (રૂપિયામાં)	
6	ફી/ચાર્જ ચૂકવવાપાત્ર (રૂપિયામાં)	
(a)	RE ને ચૂકવવાપાત્ર	
(b)	RE મારફતે રૂટ થર્ડ પાર્ટીને ચૂકવવાપાત્ર	
7	ચોખ્ખી વિતરિત રકમ (1-6) (રૂપિયામાં)	
8	ઉધાર લેનાર દ્વારા ચૂકવવામાં આવનાર કુલ રકમ (1 અને 5)(રૂપિયામાં)	
9	વાર્ષિક ટકાવારી દર - અસરકારક વાર્ષિક વ્યાજ દર (ટકામાં)	
10	શરતો અનુસાર વિતરણની સૂચિ અને શરતો	NA
11	હપ્તા અને વ્યાજની ચુકવણીની નિયત તારીખ	NA

- આ મુખ્ય હકીકત નિવેદન મંજૂરી પત્રની તારીખથી 3 દિવસ માટે માન્ય છે. જારી કરાયેલ મંજૂરી પત્રના નિયમો અને શરતોમાં કોઈપણ ફેરફાર મંજૂરી પત્ર અને મુખ્ય હકીકત નિવેદનને ફરીથી જારી કરવા તરફ દોરી જશે.
- આ એ વાતની પુષ્ટિ કરવા માટે છે કે મને/અમારા દ્વારા લાગુ કરાયેલ લોન સંબંધિત કી ફેક્ટ સ્ટેટમેન્ટ (KFS) (વાર્ષિક ટકાવારી દર (એપીઆર), શુલ્ક અને ચુકવણી શેડ્યૂલ સહિત) ની નકલ મને/અમને શેર કરવામાં આવી છે.

કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.

CAPRI
LOANS



- લોનની વિગતો અને મુખ્ય હકીકત નિવેદનની સામગ્રી મને/અમને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવી છે અને હું/અમે આથી પુષ્ટિ કરીએ છીએ કે મેં/અમે વાંચ્યું છે તે સમજાયું છે અને સંમત થયા છીએ.



લોન અરજી ફોર્મ


લોન એપ્લિકેશન નંબર	શાખાનું નામ	લોનની રકમ	CUID નંબર	લોન એકાઉન્ટ નંબર	રાષ્ટ્રીયતા
		₹			Indian

વ્યવસાય ની પ્વગતો

આવક નો સ્ત્રોત	લ વાષ્પમક આવક	વ્યવસાય
	₹	

ઉધાર લેનારા નો ફોટોગ્રાફ

pic



વ્યપતિરૂપવર્તિ

અરજદારનું નામ: શ્રી / શ્રીમતી / સ શ્રી		સરનામું:	
પ્લંગ:			
વૈવાહિક સ્થિતિ:		શહેર:	
જન્મ તારીખ:		પાન કોડ:	
લાયકાત:		રાજ્ય:	
ઇમેઇલ એડ્રેસ:		લેન્ડરૂઝાકમ:	
પ્રાપ્ત સંપત્તિ નંબર:		વતમર્નાન ખવાસસ્થિતિનર્નાં વધો:	
પેન કાડમ નંબર / ફોર્મ 60:			

બેંકની પ્વગતો

બેંકનું નામ	શાખાનું નામ	બેંક એકાઉન્ટ નંબર	IFSC કોડ

નોમિનીની પ્વગતો

નોમિનીનું નામ	નોમિનીનો સંબંધ	નોમિનીનો ફોન નંબર

Documents

વ્યક્તિ: 1) ફોટો ઓળખનો પુરાવો 2) રહેઠાણનો પુરાવો સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ www.capriglobal.in પર ઉપલબ્ધ KYC દસ્તાવેજીકરણ નીતિનો સંદર્ભ લો.

હું/અમે તમને વિનંતી કરું છું કે ઉપરોક્ત રકમ સામે સિક્યોરિટી તરીકે ગ્રામના કુલ દાગીના લઈને ઉપર જણાવેલ રકમ ₹ (Rupees) આપો. સોનાની વિગતો નીચે

ગીરવે મૂકેલા દાગીના ની વિગતો

વિગતો	યુનિટ્સ	શુદ્ધતા (કેરેટમાં)	કુલ વજન (ગ્રામ માં)	ફંડિંગ માટે ધ્યાનમાં લેવામાં આવેલ ચોખ્ખું વજન (ગ્રામ માં)
કુલ				

જવેલરી ફોટોગ્રાફ

pic

22 કેરેટ દીઠ પ્રમાણસર નેટ વજન છેગ્રામ છે

ગોલ્ડ વેલ્યુઅરનું નામ:

ગોલ્ડ વેલ્યુઅરનો એમ્પ્લોયી કોડ:

હું/અમે જાહેર કરીએ છીએ અને બાંયધરી આપીએ છીએ કે લોન મેળવવા માટે ગીરવે મુકેલ સોનાની શુદ્ધતા 18.00 કેરેટથી ઓછી નથી, જો કે આ હકીકત CGCL દ્વારા નિયુક્ત કરાયેલા CGCL/વેલ્યુઅર્સ દ્વારા પુનઃપુષ્ટિને આધિન છે, જેનો નિર્ણય આખરી અને મારા/અમારા માટે બંધનકર્તા રહેશે ("ધિરાણકર્તાનો રેકૉર્ડ"). બોમ્બે બુલિયન એસોસિએશન લિમિટેડ દ્વારા ટાંકવામાં આવેલા અથવા નિયમન કરેલ કોમોડિટી એક્સચેન્જ દ્વારા પ્રકાશિત ઐતિહાસિક હાજર સોનાના ભાવ અગાઉના 30 દિવસો માટે 22 કેરેટ સોનાના બંધ ભાવની સરેરાશ મુજબ ગીરવે રાખેલા સોનાનું મૂલ્ય પ્રાપ્ત થશે.

કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.

CAPRI
LOANS



સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો

ગોલ્ડ લોન અરજી નંબર:

લોન એકાઉન્ટ નંબર:

- A. અમે નીચે વર્ણવેલ સુવિધાની મંજૂરી માટે: તારીખની અરજીનો સંદર્ભ લઈએ છીએ.
- B. ઋણ લેનાર સ્વીકારે છે અને પુષ્ટિ કરે છે કે નીચે દર્શાવેલ સુવિધા માટેની અરજીમાં સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો છે (અને જે લોન લેનારને સુવિધાના સંદર્ભમાં લાગુ થશે, જો ધિરાણકર્તા દ્વારા સુવિધા માટેની વિનંતી સ્વીકારવામાં આવે તો) અને તેઓ અરજી ફોર્મ(ફોર્મ્સ) અને પ્રમાણભૂત શરતો (ગોલ્ડ લોન સુવિધા) સાથે વાંચવામાં આવશે:
- અરજદારનું નામ: શ્રી / શ્રીમતી / સુશ્રી
 - સુવિધા: ગોલ્ડ લોન
 - સ્કીમ :
 - મુદ્દલ રકમ : ₹
 - મુદત : મહિના (માનક શરતોને આધીન)
 - વ્યાજ દર : % p.a નિશ્ચિત વ્યાજ દર
 - ગણતરીની રીત: સરળ વ્યાજ દર
 - વ્યાજની ચુકવણીની નિયત તારીખ: ઉલ્લેખિત ચુકવણી શેડ્યુલ મુજબ
 - વ્યાજ અને મુદ્દલની રકમ માટે ચુકવણીની પદ્ધતિ: ઉલ્લેખિત ચુકવણી શેડ્યુલ મુજબ
 - ચુકવણીની રીત: રોકડ (₹ 19,999/- કરતાં વધુ નહીં) / RTGS/ NEFT/મોબાઇલ એપ્લિકેશન અથવા ઓનલાઇન મોડ.
 - મુખ્ય નિયત તારીખ: (સ્ટાન્ડર્ડ શરતોને આધીન)
 - ઓવરડ્રયુ દિવસો માટે ઓવરડ્રયુની રકમ પર દંડનો ચાર્જ: 3% પ્રતિ મહિને
 - રોકડ ડેન્ડલિંગ ચાર્જ : INR 25 અથવા GST સહિત રોકડ વ્યવહારના 0.25% (જે વધારે હોય તે)
 - SMS ચાર્જ : ₹7 પ્રતિ મહિનો (GST સહિત)
 - હેતુ :
 - ગીરો: સુવિધાને સુરક્ષિત કરવા માટે સોનાના દાગીના CGCL પાસે જમા કરાવવામાં આવ્યા છે અને ગીરવે મૂકેલી વસ્તુઓના માત્ર સોનાના ઘટકને મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે.
 - ઋણ લેનારાઓના સરનામા/ઈ-મેઈલ/મોબાઈલ સહિતની પત્રવ્યવહાર વિગતોમાં કોઈ ફેરફારના સંજોગોમાં, ઋણ લેનારાઓએ CGCLને લાગુ પડતા આધારભૂત KYC અથવા અન્ય દસ્તાવેજ સાથે લેખિતમાં જાણ કરવી જોઈએ, જેથી કરીને CGCL ના રેકૉર્ડમાં પત્રવ્યવહારની વિગતો અપડેટ કરી શકાય. આવી વિનંતી પ્રાપ્ત થયા પછી, CGCL ઉધાર લેનાર દ્વારા આવી વિનંતીની પ્રાપ્તિની તારીખ અને સમયનો ઉલ્લેખ કરતી રસીદ/લેખિત અથવા ઇલેક્ટ્રોનિક પુષ્ટિ જારી કરશે. CGCL એ આવી માહિતી પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસના સમયગાળામાં પ્રાધાન્યમાં તેના રેકૉર્ડમાં ઋણ લેનારાઓની પત્રવ્યવહાર વિગતો અપડેટ કરવાની રહેશે. જો ઋણ લેનારાઓ તેમના પત્રવ્યવહાર વિગતોમાં આવા ફેરફાર વિશે CGCLને જાણ ન કરે તો, CGCL તેના તમામ સંચાર, સૂચનાઓ, નોટીસો વગેરે ઋણ લેનારાઓને તેમના લોન અરજી ફોર્મમાં આપવામાં આવેલા છેલ્લા જાણ કરાયેલા સરનામા પર મોકલશે અને આવા સંદેશાવ્યવહાર, સૂચનાઓ, નોટીસો, વગેરે આવા ઉધાર લેનારાઓને આપવામાં આવી હોવાનું માનવામાં આવશે અને CGCL તેની નીતિઓ અનુસાર આગળ વધવા માટે સ્વતંત્ર રહેશે.
 - માર્જિન: ઋણ લેનારાઓએ ખાતરી કરવી જોઈએ કે દરેક સમયે કુલ બાકી રકમ ગીરવે મૂકેલ લેખોના મૂલ્યના 75% કરતા વધુ ન હોય. જો કુલ બાકી રકમ ગીરવે મૂકેલ લેખોના મૂલ્યના 75% કરતા વધુ થઈ જાય, તો CGCL લોન લેનારાઓને બાકી લોનની રકમ ચૂકવીને અથવા વધારાની સુરક્ષાના વચન દ્વારા એકાઉન્ટને નિયમિત કરવાની વિનંતી સાથે આવા ફેરફારો વિશે લેખિતમાં એટલે કે, SMS અને/અથવા ઈ-મેલ અને/અથવા રજિસ્ટર્ડ એડી/ અને અથવા વોટ્સએપ દ્વારા ઉધાર લેનારાઓને અપડેટ કરેલા સંચાર સરનામે અને/અથવા ઈ-મેલ સરનામું/મોબાઈલ દ્વારા નોટિસ દ્વારા તરત જ જાણ કરશે. આવી સૂચના મળ્યા પછી ઋણ લેનારાઓએ CGCL ને બાકી રકમની ચૂકવણી કરવી પડશે અથવા આવી સૂચના મળ્યાના 14 (ચૌદ) દિવસની અંદર વધારાની સિક્યોરિટી ગીરવે મૂકવી પડશે. ઋણ લેનારાઓ સાથેનો તમામ પત્રવ્યવહાર CGCL દ્વારા ઉધાર લેનારાઓના અપડેટ કરેલા સરનામે અને/અથવા ઈ-મેઈલ એડ્રેસ/મોબાઈલ/અને અથવા વોટ્સએપ પર કરવામાં આવશે અને તેનો ડિલિવરી પ્રૂફ CGCL દ્વારા સાચવવામાં આવશે.
 - હરાજી: શરતોના ભંગના સંજોગોમાં CGCL તેની પોલિસી અનુસાર સોનાની હરાજી કરી શકે છે.
 - CGCL લોનની રકમ, મૂલ્ય અને મુદત માટે લોન જેવા વ્યાપક પરિમાણોને ધ્યાનમાં લઈને જોખમ-આધારિત ક્રિમેત નિર્ધારણ અભિગમને અનુસરે છે,

Signed by OTP ()



ઉધાર લેનારની સહી

કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.



લાગુ વ્યાજ દર અં કંપનીના ભંડોળના ખચે અને મંજૂરીના સમયે પ્રવર્તમાન બજાર દરોનું કાયે છે. તમામ ફી અને શુલ્કનો લિગેતાં અમારો વેબસાઇટ
www.capri loans.in પર ઉપલબ્ધ છે.



ચાર્જની સૂચિ (કર સિવાય)

વિગતો	ચાર્જિસ
પ્રોસેસીંગ ફી	₹
MTM ચાર્જિસ	₹ 500
હરાજી પહેલાના ચાર્જિસ	₹ 200
હરાજી પછીના ચાર્જિસ	₹ 1500
સેસ સહિત રાજ્ય મુજબ ફેન્ડિંગ ચાર્જિસ લાગુ પડે છે	₹
એકાઉન્ટ સ્ટેટમેન્ટ	N/A
રોકડ હેન્ડલિંગ ચાર્જ(GST સહિત)	
SMS શુલ્ક (દર મહિને લાગુ)	₹7 GST સહિત
લોન કાર્યકાળ વિસ્તરણ ચાર્જ	0.15% + 18% GST
SOA - ડિજિટલ નકલ	મફત
SOA - ભૌતિક નકલ	₹50 + 18% GST
પૂર્વચુકવણી દંડ / ફોરકલોજર ચાર્જિસ	નીચે ગ્રીડ મુજબ
દિવસ	ટકાવારી
0-5 દિવસો	2% + 18% GST
6-10 દિવસો	1% + 18% GST
>10 દિવસો	0%
ભાગ રિલીઝ ચાર્જ	નીચે ગ્રીડ મુજબ
વિનંતી કરેલી લોનની રકમ	ચાર્જ
₹2,00,000 થી ઓછો	₹150 + 18% GST
₹2,00,001 થી ₹7,00,000 થી ઓછો	₹300 + 18% GST
₹7,00,001 અને તેથી વધુ	₹500 + 18% GST

જો લાગુ હોય તો રિબેટ (નીચેના ચાર્ટમાં આપેલ વ્યાજની વહેલી ચુકવણી પર % રિબેટ લાગુ)

રિબેટ સ્ટેપ-અપ યોજના હેઠળ, રિબેટ ફક્ત ત્યારે લાગુ પડે છે જ્યારે ચુકવણી કરવાની તારીખ સુધી સંચિત પૂર્ણ વ્યાજનું ચુકવણું કરવામાં આવે છે।

બકેટ	% રિબેટ
XX-XX દિવસો	0% વાર્ષિક
XX-XX દિવસો	0% વાર્ષિક
XX-XX દિવસો	0% વાર્ષિક
XX-XX દિવસો	0% વાર્ષિક
XX-XX દિવસો	0% વાર્ષિક

- ઋણ લેનારા દરેક વ્યવહાર દસ્તાવેજની એક કોપી પ્રાપ્ત કરી હોવાનો સ્વીકાર કરે છે અને પુષ્ટિ કરે છે અને સંમત થાય છે કે આ પત્ર વ્યવહાર દસ્તાવેજોનો ભાગ છે.
- લેનારા સમજે છે કે તમામ ચુકવણી રસીદો ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે જ પ્રદાન કરવામાં આવે છે. તેમ છતાં, જો ભૌતિક ચુકવણીની પુષ્ટિ જરૂરી હોય, તો કૃપા કરીને અમારી શાખામાંથી તે મેળવો.
- હું આથી સમજું છું અને સંમત છું કે હું અરજી ફોર્મ(ફોર્મ્સ) સબમિટ કરીને એક અથવા વધુ લોન માટે અરજી કરી શકું છું અને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ ("કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ" અથવા "ધિરાણકર્તા") આવી લોન (લોન્સ) (દરેક "લોન") અથવા "સુવિધા") આપવા માટે સંમત થઈ શકે છે કે જે આ નિયમો

Signed by OTP ()



ઉધાર લેનારની સહી

કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.



અને શરતો ("માનક શરતો") દ્વારા સંચાલિત છે અથવા કરવામાં આવશે તે અરજી ફોર્મ(ફોર્મ્સ), MITC અને પક્ષકારો વચ્ચે વિનિમય થયેલ અન્ય કોઈપણ દસ્તાવેજ સાથે વાંચવામાં આવે છે (એકસાથે "ટ્રાન્ઝેક્શન દસ્તાવેજ" તરીકે ઓળખવામાં આવે છે"). અહીં વપરાયેલ પરંતુ વ્યાખ્યાયિત ન કરાયેલા કેપિટલાઇઝ્ડ શબ્દોનો એ જ અર્થ હોવો જોઈએ જે તેમને અરજી પત્રકમાં અને MITC અને વ્યવહાર દસ્તાવેજોમાં દર્શાવેલ અન્ય નિયમો અને શરતોમાં જણાવવામાં આવ્યો છે. હું અહીં ઉલ્લેખિત માનક શરતો સહિત આવી લોન (લોનો) ને સંચાલિત કરતા તમામ નિયમો અને શરતો વાંચું છું, સમજું છું, સંમત છું, સ્વીકારું છું અને કબ્બુલ કરું છું.

- D. હું/અમે જાહેર કરીએ છીએ અને બાંધધરી આપીએ છીએ કે લોન મેળવવા માટે ગીરવે મુકેલ સોનાની શુદ્ધતા 18.00 કેરેટથી ઓછી નથી, જો કે આ હકીકત CGCL દ્વારા નિયુક્ત કરાયેલા CGCL/વેલ્યુઅર્સ દ્વારા પુનઃપુષ્ટિને આધિન છે, જેનો નિર્ણય આખરી અને મારા/અમારા માટે બંધનકર્તા રહેશે ("ધિરાણકર્તાનો રેકૉર્ડ"). બોમ્બે બુલિયન એસોસિએશન લિમિટેડ દ્વારા ટાંકવામાં આવેલા અથવા નિયમન કરેલ કોમોડિટી એક્સચેન્જ દ્વારા પ્રકાશિત ઐતિહાસિક હાજર સોનાના ભાવ અગાઉના 30 દિવસો માટે 22 કેરેટ સોનાના બંધ ભાવની સરેરાશ મુજબ ગીરવે રાખેલા સોનાનું મૂલ્ય પ્રાપ્ત થશે.
- E. હું આથી પુષ્ટિ કરું છું કે ધિરાણકર્તાની સિસ્ટમ દ્વારા મને મોકલવામાં આવેલ વન-ટાઇમ પાસવર્ડ (OTP) ની ચકાસણી કરીને આ માનક શરતો મારા દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે સ્વીકારી શકાય છે. હું સમજું છું કે OTP દ્વારા આવી ચકાસણી આ માનક શરતોની મારી સ્વીકૃતિનો નિર્ણાયક પુરાવો હશે અને તે મારા પર બંધનકર્તા રહેશે.



ગ્રાહકની ધોષણા

નીચે સહી કરનાર, હું/અમે, (હવે પછીથી તેના તમામ વ્યાકરણના સ્વરૂપો અથવા "ઉધાર લેનાર" સાથે "હું" તરીકે ઓળખવામાં આવે છે અને આ શબ્દમાં તેમના અનુગામીઓ, સ્થાનાંતરિત, સોંપણીઓ અને નવીન તેમજ પરવાનગી આપવામાં આવેલ સોંપણીઓ શામેલ છે) પ્રતિનિધિત્વ કરશે અને જાહેર કરીએ છીએ કે-

- હું ભારતનો નાગરિક છું
- મેં નાદારી માટે કોઈ અરજી સબમિટ કરી નથી, મને નાદાર જાહેર કરવામાં આવ્યો નથી કે મારી સામે કોઈ નાદારી/દેવાળિયાપણાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
- આ અરજી પત્રકમાં મારા દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી અને ખરી છે.
- મેં કોઈપણ ધિરાણકર્તા અથવા લેણદારને કોઈપણ અન્ય લોનના વ્યાજ અથવા અન્ય કોઈપણ રકમની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું નથી અને મારું નામ ભારતીય રિઝર્વ બેંક ("RBI") ની વિલકુલ ડિફોલ્ટર્સની સૂચિ અને નિકાસ અને ધિરાણ ગેરંટી કોર્પોરેશનની ("ECGC") સાવધાની સૂચિ અથવા RBI દ્વારા મની લોન્ડરિંગ વિરોધી અથવા આતંકવાદને ફાઇનાન્સિંગ સામે લડવા અથવા આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રકાશિત કરાયેલ કોઈપણ પ્રતિબંધ સૂચિના સંદર્ભમાં જારી કરાયેલ કોઈપણ સૂચિ/સૂચનાઓમાં દેખાતું નથી;
- હું સોનાના દાગીના અને અન્ય લેખો ("ગીરવે મૂકેલા લેખો")નો સાચો અને કાયદેસર માલિક છું, ઉપરના કોષ્ટક A હેઠળ વધુ વિગતવાર, જે આ એપ્લિકેશન ફોર્મ ("ગીરવે મૂકેલ લેખો") હેઠળ વિનંતી કરાયેલ સુવિધા માટે સુરક્ષા તરીકે ગીરવે રાખવાની છે તે વસ્તુઓની માલિકીની ચકાસણી માટે આપવામાં આવેલ માલિકીના દસ્તાવેજો, જો કોઈ હોય તો, ટ્રાંઝેક્શન દસ્તાવેજોમાં આપવામાં આવેલી માહિતી સાથે સાચા અને સંપૂર્ણ છે અને કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવી નથી.
- હું અહીં ઉપર આપેલા સરનામે રહું છું અને તે સરનામું તમામ સંચાર માટેનું સરનામું છે અને જો મારા સરનામામાં કોઈ ફેરફાર થાય તો હું તરત જ કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને જાણ કરીશ.
- હું પુષ્ટિ કરું છું કે આ અરજી ફોર્મ હેઠળ વિનંતી કરવામાં આવી રહેલી સુવિધાને લાગુ પડતી માનક શરતો વાંચી અને સમજી લીધી છે.
- હું સમજું છું કે સુવિધાની મંજૂરી અને તે હેઠળની કોઈપણ રકમ કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડની સંપૂર્ણ વિવેકબુદ્ધિ પર છે, જે અરજીને નકારવાનો તેનો અધિકાર અનામત રાખે છે, અને તે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ આવા અસ્વીકાર માટે અથવા આવા અસ્વીકાર વિશે મને સૂચિત કરવામાં કોઈપણ વિલંબ માટે કોઈપણ રીતે જવાબદાર/જવાબદારીને પાત્ર રહેશે નહીં. હું સમજું છું અને સંમત છું કે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ અને/અથવા તેની જૂથ કંપનીઓ આ અરજી સાથે સબમિટ કરેલા ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજોને જાળવી રાખવાનો અધિકાર અનામત રાખે છે.
- મારા દ્વારા આવી વિનંતી પ્રાપ્ત કરવાની તારીખ અને સમયનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને CGCL દ્વારા રસીદ/લેખિત અથવા ઇલેક્ટ્રોનિક કન્ફર્મશન જનરેટ કરવામાં આવશે તેવી કોઈપણ માહિતીમાં કોઈપણ ફેરફાર અંગે હું તરત જ CGCL ને જાણ કરીશ અને CGCL ના અધિકૃત રેકૉર્ડ્સમાં આવા ફેરફારોના અપડેટ અંગેની પુષ્ટિ જનરેટ કરવામાં આવશે અને CGCL દ્વારા મને આ અરજી ફોર્મમાં સૂચવવામાં આવેલા રીતો દ્વારા સંભવિતપણે આવી વિનંતી પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર જાણ કરવામાં આવશે. ઋણ લેનારાઓ એ પણ બાંધધરી આપે છે કે તેઓ CGCL અને/અથવા તેની જૂથ કંપનીઓ અને/અથવા તેના એજન્ટો દ્વારા જરૂરી કોઈપણ વધારાની માહિતી/દસ્તાવેજો પ્રદાન કરશે. હું આથી જાહેર કરું છું, પુષ્ટિ કરું છું અને બાંધધરી આપું છું કે જો હું CGCL ને ઈ-મેઇલ, મોબાઇલ વગેરે સહિતનું મારું અપડેટડ કોમ્યુનિકેશન એડ્રેસ આપવામાં નિષ્ફળ જાઉં, તો નોટિસ, ઇનિમેશન વગેરે સહિત તમામ સંચાર CGCL પાસે ઉપલબ્ધ મારા લોન અરજી ફોર્મમાં મારા દ્વારા પ્રદાન કરવામાં આવેલ મારા સરનામે મોકલવામાં આવશે અને CGCL દ્વારા મોકલવામાં આવેલ આવા સંદેશાવ્યવહારને મારા પર મોકલવામાં આવ્યો હોવાનું માનવામાં આવશે અને હું કોઈપણ સંજોગોમાં કોઈપણ સંદેશાવ્યવહાર અથવા કોઈપણ સૂચનાની સેવાના સંદર્ભમાં કોઈ વિવાદ ઊભો કરીશ નહીં.
- હું સમજું છું કે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ પાસે વ્યાજના દરમાં સંભવિત રૂપે ફેરફાર કરવાનો અને સુવિધાને લાગુ પડતા ચાર્જ્સ વસૂલવાની વિવેકબુદ્ધિ હશે અને તે મને જાણ કરવામાં આવશે;
- હું/અમે ઋણ લેનાર/આવા તૃતીય પક્ષો (જરૂરીયાત મુજબ) દ્વારા કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને ઋણ લેનારનું KYC અને તૃતીય પક્ષો પાસેથી કેડિટ સંબંધિત માહિતી/દસ્તાવેજો મેળવવા માટે આપેલી સંમતિને સંમતિ/સ્વીકારીએ છીએ જેમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયા લિ., સીકેવાયસીઆર અને અન્ય એકમોનો સમાવેશ થાય છે અને આગળ સંમતિ આપીએ છીએ કે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ પોતે અથવા અધિકૃત વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચકાસણી કરી શકે છે, કેડિટ સંદર્ભો, રોજગાર વિગતો તપાસી શકે છે અને વખતો વખત ઉધાર લેનારની વાસ્તવિકતા અને/અથવા ધિરાણપાત્રતા નક્કી કરવા KYC સંબંધિત દસ્તાવેજો અથવા કેડિટ રિપોર્ટ્સ મેળવી શકે છે. મને/અમને CAPRI GLOBAL CAPITAL LIMITED તેના આનુષંગિકો, નિયમનકારી સંસ્થાઓ, સરકાર, CKYCR અને કેડિટ એજન્સીઓ અને આવી અન્ય સત્તાધિકારીઓ સાથે માહિતીની આપ-લે અને શેર કરવા સામે કોઈ વાંધો નથી.
- હું બાંધધરી આપું છું કે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને પહેલેથી જ સબમિટ કરેલી મારી KYC માહિતીમાં કોઈ ફેરફાર થયો નથી - આ ફક્ત અગાઉના અરજી ફોર્મમાં ટોપ-અપના કિસ્સામાં જ લાગુ પડે છે. [નોંધ: ઉપરોક્ત શરત ઉધાર લેનાર દ્વારા મેળવેલી અગાઉની સુવિધાના રિન્યુઅલ/ટોપ-અપના સંજોગોમાં જ લાગુ પડે છે].
- ગીરવે મૂકેલી વસ્તુઓનું મૂલ્યાંકન CGCL અથવા CGCL દ્વારા નિયુક્ત કરાયેલા વેલ્યુઅર દ્વારા કરવામાં આવશે અને વેલ્યુઅર દ્વારા પ્રદાન કરાયેલ મૂલ્યાંકન અહેવાલમાં નિર્ધારિત કરેલ ગીરવે મૂકેલી વસ્તુઓના મૂલ્યના આધારે લોનની રકમ CGCL દ્વારા નક્કી કરવામાં આવશે. આ ક્ષિત સમયાંતરે સોનાની સિક્કોરિટીની બજાર ક્ષિતને આધીન રહેશે. જો લોન મંજૂર કરવામાં આવે છે, તો લોનની રકમ મને/અમને એક મંજૂરી પત્ર દ્વારા આપવામાં આવશે જેમાં ગીરવે મૂકેલી વસ્તુઓના મૂલ્યાંકન તેમજ સુવિધા મેળવવા માટે સંબંધિત અન્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે. હું/અમે વ્યવહાર દસ્તાવેજના

નિયંત્રણ અને શરતોનું પાલન કરવા સંમત છીએ.

- n. મારા દ્વારા CGCL ને આપેલ ગીરવે મુકેલ વસ્તુઓ અને અન્ય સિક્યોરિટીઝ ત્યારે જ રીલીઝ કરવામાં આવશે જ્યારે હું CGCL ને મારા દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ, શુલ્ક, કર વગેરે સહિતની સુવિધા હેઠળ બાકી રહેલી રકમની સંપૂર્ણ ચૂકવણી કરીશ. જો ગીરવે મુકેલી વસ્તુઓની કિંમત સમયાંતરે લાગુ પડતા CGCL ના જરૂરી માર્જિન કરતાં નીચે આવે તો, માનક શરતોના ક્લોઝ 7 હેઠળ ડિફોલ્ટની ઘટના જાહેર કરવાના અધિકારના પૂર્વગ્રહ વિના/અથવા ગીરવે મુકેલા વસ્તુઓ વેચવાના અધિકાર અને/અથવા CGCL પાસે ઉપલબ્ધ અન્ય કોઈપણ અથવા ઉપાયોને અમલમાં મૂકવાના અધિકારો અહીં અથવા કોઈપણ લાગુ કાયદા હેઠળ, હું/અમે, આ સંદર્ભે CGCL તરફથી નોટિસ મળ્યાના 14 (ચૌદ) દિવસની અંદર, CGCL ની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, CGCL પાસે, જરૂરિયાત મુજબ આવી વધારાની સિક્યોરિટી જમા કરાવીશું. CGCL ના આનુષંગિકો તરીકે CGCL કાયદા દ્વારા હકદાર હોઈ શકે તેવા કોઈપણ સામાન્ય પૂર્વાધિકાર અથવા સમાન અધિકાર ઉપરાંત, CGCL તરફની જવાબદારીઓ વસૂલવા અને કોઈપણ અન્ય ખાતા પર CGCL ને મારી/અમારી કોઈપણ જવાબદારીઓ સંતોષવા માટે અથવા આવા કોઈપણ એક અથવા વધુ ખાતાની ક્રેડિટ માટે અથવા અન્ય કોઈપણ સંદર્ભમાં, આવી જવાબદારીઓ વાસ્તવિક અથવા આકસ્મિક, પ્રાથમિક અથવા કોલેટરલ અને અનેક અથવા સંયુક્ત હોય તેવી કોઈ પણ રકમ અથવા રકમોને માંડવાળ અથવા ટ્રાન્સફર કરવા માટે, CGCL કોઈપણ સમયે અને મને/અમને સૂચના આપ્યા વિના મારા/અમારા તમામ અથવા કોઈપણ એકાઉન્ટને એકીકૃત અથવા ભેગા કરી શકે છે.
- o. હું/અમે વાસ્તવિક ધોરણે સ્ટેમ્પ ડ્યુટી અને કાયદાકીય ખર્ચ અને અન્ય ચાર્જ અને ખર્ચ સહિત તમામ ખર્ચ, ચાર્જ અને ખર્ચ ચૂકવીશું જે લોન સંબંધિત અને/અથવા આકસ્મિક દસ્તાવેજો તૈયાર કરવા માટે, તેમજ બનાવેલ સુરક્ષાના અમલીકરણ અથવા પ્રયાસો માટે પણ ખર્ચવામાં આવી શકે છે. હું/અમે તમને ગોલ્ડ લોનના કોઈપણ ચાર્જ/સર્વિસિંગ માટે CGCL પાસે રાખેલા મારા/અમારા ખાતા(ખાતાઓ)ને ડેબિટ/ક્રેડિટ કરવા માટે અધિકૃત કરીએ છીએ.
- p. હું/અમે સંમત છીએ કે, RBI ની માર્ગદર્શિકા મુજબ ખાતાઓનું NPA તરીકે વર્ગીકરણ ઋણ લેનાર મુજબ કરવામાં આવે છે અને ફેક્ટરી મુજબ નહીં અને મારા/અમારા દ્વારા અહીં લીધેલી લોન અથવા CGCL પાસેથી લીધેલી કોઈપણ ફેક્ટરી અને પરિણામે CGCL સાથે ઉધાર લેનારના અન્ય તમામ લોન એકાઉન્ટ ની ચૂકવણી ન કરવાના સંજોગોમાં તેથી તે નોંધવામાં આવે છે કે RBI દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવશે અને તે CGCL ને આવા લોન ખાતાઓમાં નિયમિત/ચૂકવણીને ધ્યાનમાં લીધા વિના, સમાન ગ્રાહક દ્વારા CGCL પાસેથી મેળવેલી આવી બધી લોન/ફેક્ટરીની પરત માંગ કરવા માટે હકદાર રહેશે.
- q. મને/અમને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ અને/અથવા તેની ગ્રૂપ કંપનીઓ અને/અથવા તેના એજન્ટો મને/અમને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ અને/અથવા તેની ગ્રૂપ કંપનીઓ દ્વારા (ટેલિફોન કોલ્સ, SMS/Whatsapp/ઈમેલ, પત્રો વગેરે સહિત) કોઈપણ મોડ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ, ઓફર્સ અને સેવાઓ વિશે માહિતી પ્રદાન કરે છે તેની સામે કોઈ વાંધો નથી અને ઉપરોક્ત હેતુ માટે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ અને/અથવા તેની ગ્રૂપ કંપનીઓ અને/અથવા તેના એજન્ટોને અધિકૃત કરીએ છીએ.
- r. હું સમજું છું અને સંમત થાઉં છું કે મારા અરજી પત્રની સ્વીકૃતિની તારીખથી મારું લોન ખાતું બંધ થાય ત્યાં સુધી, CGCL દ્વારા મને લોનના વિતરણ, લેણાંની ચૂકવણી, નિયત તારીખની સૂચના, માર્જિન અથવા લોન રિફોલ નોટિસ, કોલેટરલ રિલીઝ અથવા સંપર્ક નંબર/બેંક વિગતો/ખાતાની વિગતો/નોમિની/કેવાયસી વિગતો વગેરેમાં ફેરફાર સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નહીં હોય તેવા તમામ સંદેશાવ્યવહારની પરિસ્થિતિ મુજબ, મારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેઇલ આઈડી પર SMS/whatsapp અને/અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે. અહીં કોઈપણ સમાવિષ્ટ હોવા છતાં, ધિરાણકર્તાને ઉપરોક્ત વિગતોની વાતચીત કરવા માટે સંચારના અન્ય કોઈપણ માધ્યમોનો ઉપયોગ કરવાની વિવેકબુદ્ધિ છે અને તે મને સ્વીકાર્ય રહેશે. વધુમાં, હું પુષ્ટિ કરું છું કે વન-ટાઇમ પાસવર્ડ (OTP), જ્યાં જરૂરી હોય ત્યાં, CGCL ની સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવશે અને મારી લોન તૈયાર કરવા, ગ્રાહક આઈડી બનાવવા, મારી લોનની ચૂકવણી કરવા અને બંધ કરવા માટે મોબાઇલ નંબર/એકાઉન્ટની વિગતોમાં ફેરફાર કરવાના હેતુ માટે મારા રજિસ્ટર્ડ નંબર પર SMS/whatsapp અથવા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી દ્વારા પ્રાપ્ત થશે, અને હું સમજું છું કે OTP દ્વારા આવી ચકાસણી મારા નામે લોન તૈયાર કરવા અથવા ઉપરોક્ત વિગતોમાં ફેરફાર માટે મારી સ્વીકૃતિનો નિર્ણાયક પુરાવો હશે.
- s. ટ્રાન્ઝેક્શન દસ્તાવેજોમાં મારા દ્વારા પ્રદાન કરવામાં આવેલ દસ્તાવેજો અને માહિતીની વાસ્તવિકતા માટે હું સંપૂર્ણપણે જવાબદાર હોઈશ અને CGCL મારા દ્વારા સબમિટ કરેલા દસ્તાવેજોમાં પ્રતિબિંબિત થતી કોઈપણ ખામી અથવા ભૂલો માટે/ટ્રાન્ઝેક્શન દસ્તાવેજોમાં પૂરી પાડવામાં આવેલ કોઈપણ માહિતી માટે જવાબદાર રહેશે નહીં.
- t. હું સમજું છું અને સંમત છું કે CGCL પાસે કોઈપણ તૃતીય પક્ષનો સંપર્ક કરવાનો અધિકાર છે જેની પાસેથી દસ્તાવેજો મેળવ્યા હતા, જેમાં ગીરવે મુકેલી વસ્તુઓ માટે પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે, જેથી દસ્તાવેજો/ગીરવે મુકેલી વસ્તુઓની વાસ્તવિકતા ચકાસી શકાય.

માનક નિયમો અને શરતો

1. મંજૂરી અને ચૂકવણી

1. હું સમજું છું અને સંમત છું કે શાહુકાર મારા દ્વારા કરાયેલી રજૂઆતોના આધારે ધિરાણકર્તા પાસે ગીરવે રાખેલા સોનાના દાગીના/આભૂષણો ("સુવિધા") સામે લોન આપી શકે છે અને જો મારા દ્વારા આપવામાં આવેલ કોઈપણ માહિતી, હકીકત, દસ્તાવેજ અથવા લેખ ખોટો, ખોટો, બનાવટી, ખામીયુક્ત, 18 કેરેટથી ઓછો હોય, તો CGCL, આ અરજી ફોર્મનો એક ભાગ બનાવતા માનક નિયમો અને શરતોના કલોઝ 7 હેઠળ તેને ઉપલબ્ધ અધિકારોની અવગણના કરવા ઉપરાંત અને કાયદા મુજબ મારી સામે યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવાના તેના અધિકારો અનામત રાખે છે. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા મને લોન આપી શકે છે (દરેક વિતરણને "લોન" તરીકે ઓળખવામાં આવે છે) ફક્ત એપ્લિકેશન ફોર્મમાં ઉલ્લેખિત હેતુ માટે.

2. હું તે સમજું છું અને સંમત છું કે CGCLની સંપૂર્ણ વિવેકબુદ્ધિ પર અને માત્ર CGCL દ્વારા આ સંદર્ભે લેખિત વિનંતી પૂરી પાડવા પર અને CGCLનો ઉપરોક્ત નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે ત્યારે લોન મહત્તમ 3 (ત્રણ) વર્ષ માટે લંબાવી શકાય છે. જો કે, હું સમજું છું અને સંમત છું કે લોનની પ્રારંભિક ગ્રાન્ટ અરજી ફોર્મમાં નિર્ધારિત મુદત (મૂળની નિયત તારીખ સાથે) માટે જ હશે અને ત્યાર બાદ ધિરાણકર્તા વખતો વખત મુદત (અને સંબંધિત મુદતની નિયત તારીખ) વધારવા માટે તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. વધુમાં જો કે, ધિરાણકર્તા દ્વારા સ્પષ્ટ લેખિત અથવા ઇલેક્ટ્રોનિક સંચારની ગેરહાજરીમાં, જેમ બને તેમ, એક્સ્ટેન્શન જણાવતા, છેલ્લી વાતચીતની મુદત અને મુખ્ય નિયત તારીખ અંતિમ માનવામાં આવશે અને ઋણ લેનાર આ અરજી ફોર્મના ભાગરૂપે બનેલા માનક નિયમો અને શરતોના કલોઝ 7 હેઠળ પૂરા પાડવામાં આવેલ ઉધાર લેનાર દ્વારા કરવામાં આવેલી ડિફોલ્ટની કોઈપણ ઘટના બનવાના સંજોગોમાં CGCL દ્વારા લોનની મુદત વધારવાના સંદર્ભમાં કોઈપણ મૌખિક ખાતરી/ઉપયોગ/પુષ્ટિ આપવામાં આવી હોવાના આધારે ધિરાણકર્તા દ્વારા શરૂ કરાયેલા પગલાંને પડકારવા માટે હકદાર નથી,

3. હું સમજું છું અને સંમત છું કે જો ધિરાણકર્તા સુવિધા માટેની મારી વિનંતી સ્વીકારે છે અને સુવિધાને મંજૂરી આપે છે, તો ધિરાણકર્તા મારા બેંક ખાતામાં લોનનું વિતરણ કરી શકે છે. મંજૂર સુવિધા રૂ. 20,000/- (માત્ર વીસ હજાર રૂપિયા) કરતાં ઓછી હોય તેવા સંજોગોમાં, ધિરાણકર્તા તેને રોકડ દ્વારા પણ વિતરિત કરી શકે છે, ફક્ત તેની વિવેકબુદ્ધિ પર જ આખરી હશે અને મારા માટે બંધનકર્તા રહેશે અને ધિરાણકર્તા, કોઈપણ રીતે, રોકડ દ્વારા લોનના વિતરણ અંગે મારા દ્વારા કરવામાં આવેલી વિનંતીને સ્વીકારવા માટે બંધાયેલા નથી.

2. વ્યાજ, અન્ય ખર્ચ અને ચૂકવણી

1. હું સમજું છું અને સંમત છું કે લોન(લોનો) પરના વ્યાજ અને શુલ્ક વ્યવહાર દસ્તાવેજમાં ઉલ્લેખિત કર્યા મુજબ લેવામાં આવશે અને હું સ્વીકારું છું અને સંમત છું કે ઉલ્લેખિત વ્યાજનો દર વાજબી છે અને ધિરાણકર્તા દ્વારા નિર્ધારિત કર્યા મુજબ સંભવતઃ બદલાઈ શકે છે અને આવા ઉદ્દેશિત ફરફાર વિશે મને અગાઉ લેખિત સૂચના આપી શકે છે.

2. હું સમજું છું અને સંમત છું કે તમામ આવકવેરો, અન્ય કોઈપણ કર જવાબદારીઓ, સ્ટેમ્પ ડ્યુટી સહિતની ફરજો અને સુવિધાના સંબંધમાં સંબંધિત નોંધણી અને ફાઇલિંગ ચાર્જિસ (લાગુ હોય તે મુજબ) મારા દ્વારા વહન કરવામાં આવશે અને જો મારા ખાતા પર ધિરાણકર્તા દ્વારા આવો કોઈ ખર્ચ કરવામાં આવ્યો હોય, તો હું તરત જ ધિરાણકર્તાને તેની ભરપાઈ કરીશ.

3. હું સમજું છું અને સંમત છું કે વાસ્તવિક/ઘટતા બેલેન્સ પર વ્યાજ વસૂલવામાં આવશે જો વર્ષ લીપ વર્ષ માટે 365 દિવસ અથવા 366 દિવસનું હોય અને વ્યાજ માસિક અંતરાલે ચૂકવવાપાત્ર રહેશે, સિવાય કે અન્યથા ઉલ્લેખિત હોય.

4. હું સમજું છું અને સંમત છું કે સુવિધાના સંદર્ભમાં વ્યાજ, મુદતની રકમ અથવા અન્ય કોઈ બાકી રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ જવાના સંજોગોમાં, ધિરાણકર્તા દ્વારા નિર્દિષ્ટ કરેલ વધારાનું વ્યાજ વસૂલવામાં આવશે.

5. હું સમજું છું અને સંમત છું કે હું દરેક ચૂકવણી (મુક્ત રીતે ટ્રાન્સફર કરી શકાય તેવા ભંડોળમાં, કોઈપણ માંડવાળ, પ્રતિદાવા અથવા કોઈપણ કપાત વિના) સંબંધિત નિયત તારીખે અથવા તે પહેલાં કરીશ અને જો નિયત તારીખ વ્યવસાય દિવસ ન હોય તો, હું અગાઉના કામકાજના દિવસે ચૂકવણી કરવા માટે સંમત છું.

6. લોન ખાતામાં દંડનીય શુલ્ક વસૂલવાથી બચવા માટે, ગ્રાહક દ્વારા યોગ્ય રીતે સ્વીકારવામાં આવેલી લોનના સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતોમાં ઉલ્લેખિત ચૂકવણી શેડ્યૂલ મુજબ નિયત તારીખો પર વ્યાજની ચૂકવણી કરવાની જવાબદારી ઉધાર લેનાર/ની છે.

3. સોનાના સંબંધમાં શરતો

1. હું સમજું છું અને સંમત છું કે સોનાના આભૂષણો/દાગીના (આવા દાગીના સાથે જોડાયેલ કોઈપણ પથ્થર અથવા હીરા સાથે)નો હું સંપૂર્ણ માલિક છું અને અને તે મારા દ્વારા કાયદેસર/સાચા સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે, [જેને લગતા દસ્તાવેજો મારા દ્વારા યોગ્ય રીતે સબમિટ કરવામાં આવ્યા છે] જે ધિરાણકર્તા પાસે પ્રથમ અને વિશિષ્ટ ચાર્જ ("ગીરવે મૂકેલ લેખો") દ્વારા સીલબંધ પેકેટમાં ગીરવે મુકવામાં આવ્યા છે અને ધિરાણકર્તાની તરફેણમાં કરવામાં આવેલ છે તે સિવાય તેના પર કોઈ પૂર્વાધિકાર, બોજ, ચાર્જ(ચાર્જિસ) અથવા દાવા(દાવાઓ) નથી.

2. હું તે સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા, કોઈપણ પૂર્વ સૂચના અથવા સૂચના આપ્યા વિના, લોનના સમયગાળા દરમિયાન આવા સીલબંધ પેકેટો ખોલવા અને મારા જોખમ અને મારા ખર્ચે આવી મુદત દરમિયાન કોઈપણ સમયે ગીરવે મૂકેલ વસ્તુઓ (વજન પરીક્ષણ / રંગ પરીક્ષણ / પથ્થર ઘસવું, એસિડ અને મીઠાનું પરીક્ષણ / ફ્લેક્સ પરીક્ષણ / ગંધ પરીક્ષણ / ધ્વનિ પરીક્ષણ / ઉપયોગિતા પરીક્ષણ / ગલન / કટીંગ / વિનાશક પરીક્ષણો

અથવા ગૌરવ રાખેલા લંબાં પરના અન્ય પરોક્ષણો સાહિત પણ મર્યાદિત નથી)ની ગુણવત્તા, મૂલ્ય અથવા શુદ્ધતાના સંબંધમાં તપાસ/તપાસી ચલાવવાનો હકદાર રહેશે અને હું આથી તેના માટે સંમતિ આપું છું. હું સમજું છું, સંમત છું અને બાંધધરી આપું છું કે ધિરાણકર્તાના તારણો અંતિમ અને બંધનકર્તા રહેશે અને હું કોઈપણ રીતે તેનો વિવાદ કરીશ નહીં.

3. હું સમજું છું અને સંમત છું કે મારા દ્વારા ધિરાણકર્તાને ગીરવે મૂકેલ વસ્તુઓ અને અન્ય કોઈપણ સિક્યોરિટી ધિરાણકર્તાના સંતુષ્ટિ માટે મારા દ્વારા લોન (લોનો) હેઠળ બાકી રહેલ બાકી રકમની સંપૂર્ણ ચૂકવણી થવા પર જ છૂટી કરવામાં આવશે.

1 હું સમજું છું અને સંમત છું કે ગીરવે મૂકેલી વસ્તુઓ માટેનું મારું શીર્ષક ખામીયુક્ત નથી અથવા કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ રીતે પડકારવામાં આવ્યું નથી. વધુમાં, ગીરવે મૂકેલી વસ્તુઓ ખોટી અથવા હલકી ગુણવત્તાની નથી.

4. હું સમજું છું અને સંમત છું કે ચોરી અથવા કોઈપણ કુદરતી આફત જેવી કે આગ, પૂર, ધરતીકંપ વગેરેના કારણે ગીરવે મૂકેલ વસ્તુઓ ખોવાઈ જવાના સંજોગોમાં, ધિરાણકર્તાની જવાબદારી ધિરાણકર્તાના તમામ બાકી લેણાંને એડજસ્ટ કર્યા પછી તેના જેટલી રકમ સાથે ખોવાયેલા ગીરવે મૂકેલ લેખોને બદલવા સુધી મર્યાદિત છે અને વધુમાં, તે રિલેસમેન્ટ ખર્ચની ગણતરી વજન અને શુદ્ધતા (ધિરાણકર્તાના રેકૉર્ડમાં જાળવવામાં આવ્યા મુજબ)ના આધારે કરવામાં આવશે અને પ્રકાશિત ડેટા મુજબ સોનાની વર્તમાન તારીખ કિંમત દ્વારા ગુણાકાર કરવામાં આવશે અને તે મારા માટે અંતિમ અને બંધનકર્તા રહેશે.

4. ગીરવે મૂકેલા વસ્તુઓનું મૂલ્યાંકન

1. હું તે સમજું છું અને સંમત છું કે ગીરવે મૂકેલી વસ્તુઓનું મૂલ્યાંકન ધિરાણકર્તા દ્વારા અધિકૃત અને નિમણૂક કરાયેલ મૂલ્યાંકનકર્તા દ્વારા કરવામાં આવશે અને લોનની રકમ ધિરાણકર્તા દ્વારા પૂરા પાડવામાં આવેલ મૂલ્યાંકન અહેવાલમાં નિર્ધારિત કરાયેલા ગીરવે મૂકેલી વસ્તુઓના મૂલ્યના આધારે નક્કી કરવામાં આવશે, જે માત્ર લોનના વિતરણના હેતુ માટે હોવાનું માનવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં તેને અંતિમ ગણવામાં આવશે નહીં. આવા મૂલ્યાંકન પરિબલોને કારણે ફેરફારને આધીન રહેશે, જેમાં સમયાંતરે ગોલ્ડ સિક્યોરિટીના બજાર ભાવમાં ફેરફાર, લોનના વિતરણ પછી કોઈપણ તબક્કે CGCL દ્વારા હાથ ધરવામાં આવેલ આંતરિક ઓડિટ, જ્યાં ગીરવે મૂકેલી વસ્તુઓ 18.00 કરેટ કરતાં ઓછી શુદ્ધતા ધરાવતા હોવાનું જણાય વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી.

2. હું સમજું છું, સંમત છું અને પુષ્ટિ કરું છું કે ધિરાણકર્તાના રેકૉર્ડમાં નોંધાયેલી ગીરવે મૂકેલી વસ્તુઓની કિંમત સ્વીકાર્ય, નિર્ણાયક, અંતિમ અને મારા માટે બંધનકર્તા છે અને કોઈપણ સમયે કોઈ પણ રીતે તેનો વિવાદ કરવામાં આવશે નહીં.

3. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા દ્વારા મને મંજૂર કરવામાં આવેલી લોનનો અર્થ એ નથી કે ધિરાણકર્તા પુષ્ટિ કરે છે અથવા સ્વીકારે છે કે ગીરવે મૂકેલ સોનાના દાગીના ચોક્કસ કરેટ શુદ્ધતાના છે.

4. હું સમજું છું અને સંમત છું કે જો ગીરવે મૂકેલી વસ્તુ નક્કી અથવા હલકી ગુણવત્તાની અથવા ઓછી શુદ્ધતાની અથવા ચોરાયેલી હોવાનું જાણવા મળે તો, ધિરાણકર્તા યોગ્ય માનવામાં આવે તે રીતે યોગ્ય તપાસ/ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર અનામત રાખે છે અને જો ધિરાણકર્તાને આના કારણે કોઈ નુકસાન થાય, તો હું તેના માટે સંપૂર્ણપણે જવાબદાર અને જવાબદારીને પાત્ર રહીશ.

5. હું સમજું છું અને સંમત છું કે કોઈ પણ મૂલ્યાંકન હેતુ માટે ગીરવે મૂકેલી વસ્તુઓના માત્ર સોનાના ઘટકોને ધ્યાનમાં લેવામાં આવશે અને ધિરાણકર્તા કોઈપણ સમયે ઘરેણા/ઝવેરાતમાં જડિત પત્થરો અથવા હીરાના મૂલ્યને ધ્યાનમાં લેશે નહીં, જેમાં નુકસાનની બદલીનો સમય પણ સામેલ છે.

5. માર્જિન

1. હું સમજું છું અને સંમત છું કે હું હંમેશા એ સુનિશ્ચિત કરીશ કે ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો હેઠળ બાકી રહેલી કુલ રકમ ધિરાણકર્તાના રેકૉર્ડમાં જાળવવામાં આવેલી ગીરવે મૂકેલી વસ્તુઓના મૂલ્યના 75% અથવા ધિરાણકર્તા દ્વારા સમયાંતરે નિર્ધારિત કરવામાં આવતી અન્ય ટકાવારી("માર્જિન")થી વધુ ન હોય. જો સુવિધા માટે બાકી રહેલી કુલ રકમ તે દિવસના દરના આધારે કુલ ગીરવે મૂકેલી વસ્તુઓના મૂલ્યના 80% (એસી) કરતાં વધી જાય, તો મને તેની જાણ કરવામાં આવશે, જેના અનુસંધાનમાં હું ગીરવે મૂકેલી વસ્તુઓની કિંમતના 75% સુધી આવી સૂચના આપ્યાના 14 (ચૌદ) દિવસની અંદર કાં તો વધારાની ગોલ્ડ સિક્યોરિટી પ્રદાન કરીશ અથવા લાગુ વ્યાજ, શુલ્ક, ફી વગેરે સહિત બાકી લોનની રકમ ચૂકવીશ.

2. હું સમજું છું અને સંમત છું કે ગીરવે મૂકેલી વસ્તુઓની કિંમતનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે અને જો બજાર કિંમતોમાં વધઘટને કારણે ગીરવે મૂકેલી વસ્તુઓની કિંમત માર્જિન જરૂરિયાતોથી ઓછી હોય, તો ધિરાણકર્તા વધારાની સિક્યોરિટી અથવા માંગ ઊભી કરવા માટે પગલાં લેશે લોનની આંશિક અથવા સંપૂર્ણ ચૂકવણી અને હું આવી માંગ પર તરત જ માંગનું પાલન કરીશ, અને કોઈ પણ સંજોગોમાં આવી માંગના 14 (ચૌદ) દિવસ પછી નહીં.

3. હું સમજું છું અને સંમત છું કે મારા દ્વારા વધારાના માર્જિનની આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, માર્જિન જાળવવામાં આવા દરેક ઉલ્લંઘન માટે લાગુ પડતા વધારાના શુલ્ક ધિરાણકર્તા દ્વારા વસૂલવામાં આવશે અને મારે કોઈપણ વિલંબ, વાંધો કે વિરોધ કર્યા વિના ચૂકવણી કરવી પડશે.

4. હું સમજું છું અને સંમત છું કે, અહીં કંઈપણ દર્શાવેલ હોવા છતાં, જો ધિરાણકર્તાના મતે, ગીરવે મૂકેલ વસ્તુઓનું મૂલ્ય મારી જવાબદારીઓ નિભાવવા માટે પૂરતું નથી અથવા જો કોઈ સંજોગ/સંજોગો અસ્તિત્વમાં છે કે જે આ માનક શરતો હેઠળ મારી જવાબદારીઓને પૂર્ણ કરવાની મારી

ક્ષમતાના ભૌતિક રીતે અસર કરે છે તાં, ધિરાણકર્તા આ માનક શરતોના કલમ 7 માં દર્શાવેલ પ્રાકૃત્ય અનુસાર મુદતની સમાપ્તિ પહેલાં કોઈપણ સમયે હરાજી દ્વારા ગીરવે મૂકેલ વસ્તુઓ વેચી શકે છે અને હું આથી તે માટે સંમતિ આપું છું અને કોઈપણ સમયે કોઈપણ રીતે તેનો વિવાદ કરીશ નહીં. વધુમાં, જો બાકી રકમ કુલ મૂલ્યના 100% કરતાં વધી જાય તો મંજૂર મૂલ્ય તે મહિના માટે હરાજીપાત્ર ગીરોનો ભાગ બનશે અને આવી હરાજી નીચેની કલમ 7.8 મુજબ સંચાલિત થશે.

6. કરાર

- હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા દ્વારા કોઈપણ વ્યવહારના દસ્તાવેજોના કોઈપણ ઉલ્લંઘન અથવા સુવિધા અથવા ગીરવે મૂકેલી વસ્તુઓના સંદર્ભમાં શાહુકાર દ્વારા કરવામાં આવેલી કોઈપણ ખોટી રજૂઆતના પરિણામે હું તમામ નુકસાન, ખર્ચ, ચાર્જ, હાનિ, કોસ્ટ અને જવાબદારીઓ (કોઈપણ ત્રાહિત પક્ષના દાવાઓના કારણ સહિત) માંથી અને તેની સામે ધિરાણકર્તાને થતા નુકસાનની ભરપાઈ કરીશ, નુકસાનની ભરપાઈ કરતો રહીશ અને નુકસાનથી બચાવીશ. હું સમજું છું અને સંમત છું કે હું લોન (લોનો)ના સંબંધમાં થયેલા કોઈપણ ખર્ચ અને કોસ્ટ માટે ધિરાણકર્તાને વળતર આપીશ, જેમાં કોઈપણ વિલંબ, વાંધો અથવા વિરોધ વિના સિક્યોરિટીઝનો વીમો, અમલીકરણ ખર્ચ, કરના તમામ બાકી લેણાં અને સરકારના કોઈપણ અન્ય શુલ્ક વગેરેની પતાવટનો સમાવેશ થાય છે.
- હું સમજું છું અને સંમત છું કે હું નીચે આપેલી સુવિધાનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં (પ્રાથમિક સોનું, સોનાના દાગીના, સોનાના આભૂષણો, સોનાના સિક્કા, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ સહિત)માં સોનું ખરીદવા માટે કરીશ નહીં.
- હું સમજું છું અને સંમત છું અને સ્વીકારું છું કે ભારતીય કરાર અધિનિયમ, 1872 અથવા કોઈપણ અન્ય લાગુ કાયદાની કોઈપણ જોગવાઈઓ અથવા વ્યવહાર દસ્તાવેજોમાં સમાવિષ્ટ કંઈપણ હોવા છતાં, મારા દ્વારા ચૂકવવામાં આવેલી રકમ પ્રથમ ખર્ચ, ચાર્જ અને ખર્ચ અને અન્ય નાણાં માટે; બીજું વિલંબિત ચૂકવણી પર ચાર્જ તરફ; ત્રીજું ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો હેઠળ ચૂકવવાપાત્ર વ્યાજ તરફ અને છેલ્લે કોઈપણ મુદ્દલ રકમની ચૂકવણી તરફ ફાળવવામાં આવશે.
- સમજું છું અને સંમત છું કે હું સમયાંતરે ધિરાણકર્તા દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો/માહિતી પ્રદાન કરીશ અને તે કે ધિરાણકર્તા પોતે અથવા તેના એજન્ટો દ્વારા સમયાંતરે આપેલી કોઈપણ માહિતીની ચકાસણી કરી શકે છે, કેડિટ સંદર્ભો, રોજગાર વિગતો તપાસી શકે છે અને કેડિટ રિપોર્ટ્સ અથવા અન્ય કોઈપણ માહિતી જે ધિરાણકર્તા દ્વારા જરૂરી માનવામાં આવે છે તે મેળવી શકે છે.

7. ડિફોલ્ટની ઘટનાઓ: હું સમજું છું અને સંમત છું અને સ્વીકારું છું કે નીચેનામાં ડિફોલ્ટની ઘટનાઓ શામેલ હશે:

- ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ્સ અથવા CGCL પાસેથી મેળવેલી અન્ય કોઈપણ સુવિધા હેઠળ કોઈપણ નાણાની ચૂકવણી/ચૂકવણીમાં ડિફોલ્ટ (ભલે જણાવેલ નિયત તારીખે, પ્રવેગક દ્વારા અથવા અન્યથા) થયું હોય
- ટ્રાન્ઝેક્શન દસ્તાવેજોના કોઈપણ કરારની કામગીરીમાં ડિફોલ્ટ (ચૂકવણી ડિફોલ્ટ સિવાય) અને આવા કરારનો આવા ભંગના 3 (ત્રણ) દિવસની અંદર ઉપાય કરવામાં આવતો નથી.
- હું નાદાર બની જાઉં, અથવા સ્વેચ્છાએ અથવા અનૈચ્છિક રીતે, કોઈપણ નાદારી અથવા નાદારી કાયદા હેઠળ મારી કાર્યવાહીને પાત્ર બનવાની વાજબી આશંકા હોય.
- 3 હપ્તાઓ અથવા લેણાંની ચૂકવણીમાં મારા દ્વારા ડિફોલ્ટ થવાના સંજોગોમાં.
- ઋણ લેનારાના મૃત્યુ પછી, અથવા ઉધાર લેનાર દ્વારા નાદારીની કાર્યવાહી થવાના સંજોગોમાં.
- ગીરવે મૂકેલ વસ્તુઓ અથવા અહીં આપેલી કોઈપણ અન્ય સિક્યોરિટી, જો કોઈ હોય તો, બજાર કિંમતમાં ફેરફાર અથવા અન્ય કોઈ કારણોસર, સમયાંતરે નિર્ધારિત જરૂરી માજિન કરતાં નીચી આવે તેવા સંજોગોમાં, અને 5.1 અનુસાર તેને ફરી ભરવામાં નિષ્ફળ જાય છે, જેના પરિણામે બાકી લોન અને/અથવા વ્યાજની વસૂલાત માટેની સુરક્ષા અસંતોષકારક બની જાય છે.
- કોઈપણ વ્યવહારના દસ્તાવેજો હેઠળ મારી કોઈપણ રજૂઆત ખોટી, ગેરમાર્ગે દોરનારી અથવા અસત્ય હોવાનું જણાયું હોય તો.
- જો ગીરવે મૂકેલી વસ્તુની ગુણવત્તાના સંદર્ભમાં કોઈ પ્રણાલીગત છેતરપિંડી મળી આવે તેવા સંજોગોમાં.
- એવી પરિસ્થિતિમાં જ્યાં કુલ બાકી રકમ ગીરવે મૂકેલી વસ્તુઓના મૂલ્યના 75% કરતા વધી જાય.
- ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો હેઠળના કોઈપણ નિયમો અને શરતોનું પાલન/પૂર્ણ કરવામાં મારી નિષ્ફળતાના સંજોગોમાં
- ઉપરના ક્લોઝ 7.1 થી 7.9 માં દર્શાવેલ કોઈપણ ડિફોલ્ટના સંજોગોમાં, CGCL મને નોટિસ મોકલશે જેમાં :- (a) ડિફોલ્ટ(ડિફોલ્ટ્સ) / ખામી(ઓ) સુધારવા; (b) ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ્સ મુજબ વ્યાજ અને તમામ ચૂકવવાપાત્ર રકમ સાથે સવલતની બાકી રહેલ રકમ તરત જ ચૂકવવા; (c) સુવિધા અને/અથવા મારા તરફથી કોઈપણ કૃત્ય અથવા ડિફોલ્ટને કારણે ધિરાણકર્તા દ્વારા કરવામાં આવેલા તમામ દાવા, ખર્ચ, નુકસાન અને નોટિસ મળ્યાની તારીખથી 14 (ચૌદ) દિવસમાં બાકી લેણાંની વસૂલાત (કાનૂની/વકીલની ફી સહિત) માટે ખર્ચ ચૂકવવા માટે મને બોલાવવામાં આવશે. હું નિર્ધારિત સમયની અંદર ડિફોલ્ટને સુધારવામાં નિષ્ફળ જાઉં, તો CGCL મને બીજી નોટિસ મોકલશે કે મને જાણ કરશે કે મારા દ્વારા ડિફોલ્ટ(ડિફોલ્ટ્સ) સુધારવામાં આવ્યા નથી તેવા સંજોગોમાં, CGCL ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી 14 (ચૌદ) દિવસ પછી ઉપરોક્ત

નાંટિસમાં દર્શાવેલ દિવસ, સમય અને સ્થળ પર ગૌરવ મૂકેલી વસ્તુઓની હરાજી કરવા માટે યાંચ્ય પગલાં લેવાની સ્વતંત્રતા રહેશે.

12. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા દ્વારા મને 14 (ચૌદ) દિવસની નોટિસ આપ્યા પછી સ્થાનિક ભાષામાં દૈનિક અખબારોમાં એક જાહેરાત અને રાષ્ટ્રીય દૈનિક અખબારમાં બીજી જાહેરાત આપીને હરાજી હાથ ધરવામાં આવશે જે હું ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 176 ના હેતુઓ માટે વાજબી સમયગાળો છે તે માટે હું સંમત છું. હું સમજું છું અને સંમત છું કે હરાજી માટે આરક્ષિત કિંમત બોમ્બે બુલિયન એસોસિએશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા 22 કરેટ સોનાના પાછલા 30 દિવસના સરેરાશ બંધ ભાવ અથવા નિયમન કરેલ કોમોડિટી એક્સચેન્જ દ્વારા પ્રકાશિત ઐતિહાસિક હાજર સોનાના ભાવના 85% કરતા ઓછી નહીં હોય અને કરેટની દ્રષ્ટિએ નીચી શુદ્ધતાના ગૌરવ મૂકેલી વસ્તુઓનું મૂલ્ય પ્રમાણસર ઘટાડવામાં આવશે.

13. હું સમજું છું અને સંમત છું કે મને ગૌરવ મૂકેલી વસ્તુઓને જાહેર હરાજી કરવાના તેના ઈરાદા અંગે CGCL દ્વારા રજીસ્ટર્ડ પત્ર/કુરીયર સેવા, SMS અથવા ટેલિફોન અથવા રૂબરૂ સૂચના અથવા ઈમેલ દ્વારા અથવા સંચારના અન્ય માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે. સરનામું/ઈમેલ/મોબાઈલ સહિત મારા પત્રવ્યવહારની વિગતોમાં કોઈ ફેરફાર થાય તો, હું CGCLને CGCLના રેકૉર્ડમાં મારા પત્રવ્યવહારની વિગતો અપડેટ કરવાની વિનંતી સાથે CGCLને લેખિતમાં જાણ કરીશ. આવી વિનંતી પ્રાપ્ત થયા પછી, CGCL મારા દ્વારા આવી વિનંતીની પ્રાપ્તિની તારીખ અને સમયનો ઉલ્લેખ કરતી રસીદ/લેખિત અથવા ઇલેક્ટ્રોનિક પુષ્ટિ જારી કરશે. CGCL તેના રેકૉર્ડમાં ઉધાર લેનારાઓના પત્રવ્યવહારની વિગતો અપડેટ કરશે અને આવી માહિતી મળ્યાની તારીખથી 30 દિવસની અંદર ખાસ કરીને ઋણ લેનારાઓને તેની પુષ્ટિ કરશે. જો હું મારા પત્રવ્યવહારની વિગતોમાં આવા ફેરફાર વિશે CGCLને જાણ ન કરું તો, CGCL તેના તમામ સંદેશાવ્યવહાર, સૂચનાઓ, નોટીસો વગેરે મને આ અરજી પત્રમાં આપેલા છેલ્લા સરનામે મોકલશે અને આવા સંદેશાવ્યવહાર, સૂચનાઓ, નોટીસો વગેરે મને આપવામાં આવી હોવાનું માનવામાં આવશે અને CGCL તેની નીતિઓ અનુસાર આગળ વધવા માટે સ્વતંત્ર રહેશે.

14. હું સમજું છું અને સંમત છું કે ભારતીય રિઝર્વ બેંક અને અન્ય સંબંધિત નિયમનકારો દ્વારા સમયાંતરે જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર હરાજી હાથ ધરવામાં આવશે.

15. હું સમજું છું અને સંમત છું કે ગૌરવ મૂકેલા લેખોના વેચાણમાંથી પ્રાપ્ત થયેલી આવકનો ઉપયોગ લોન હેઠળ બાકી લેણાંની ચુકવણી માટે કરવામાં આવશે અને જો આ રીતે પ્રાપ્ત થયેલી આવક બાકી લેણાંને પહોંચી વળવા માટે અપૂરતી હોય, તો ધિરાણકર્તા તેની મુનસફી પ્રમાણે આગળની કાર્યવાહી કરવાનો તેનો અધિકાર અનામત રાખે છે.

16. હું સમજું છું અને સંમત છું કે CGCL મારા અને મારા ડિફોલ્ટ વિશેની માહિતી સોશિયલ મીડિયા સહિત જાહેર ડોમેનમાં જાહેર કરશે અને પ્રકાશિત કરશે.

17. હું સમજું છું અને સંમત છું કે CGCL તેને કોઈપણ લાગુ કાયદા હેઠળ ઉપલબ્ધ કોઈપણ અધિકારો અથવા ઉપરોક્ત સુવિધાનો લાભ લેવા માટે અમલમાં મુકવામાં આવેલા વ્યવહાર દસ્તાવેજો લાગુ કરશે.

8. વધારાની સુવિધાઓ

1. હું સમજું છું અને સંમત છું કે હું ઓનલાઈન સુરક્ષિત પ્લેટફોર્મ (ઓનલાઈન સુવિધા)નો ઉપયોગ કરીને અથવા ધિરાણકર્તાના ટોલ-ફ્રી નંબરો પર કૉલ કરીને આગળ/વધારાની સુવિધાઓ (આવી વધારાની લોન માટે ગૌરવ ચાલુ રાખવા) માટે અરજી કરી શકું છું. જો ઋણ લેનાર ધિરાણકર્તાના લોન પરિમાણોનું પાલન કરે અને તમામ જરૂરી દસ્તાવેજો/માહિતી સબમિટ કરે તો ધિરાણકર્તા તેના વિવેકબુદ્ધિથી વધારાની લોનનો વિસ્તાર કરી શકે છે. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા પાસે ગૌરવ મૂકેલી વસ્તુઓ અને તેના વેચાણની કોઈપણ આવકના સંદર્ભમાં અને મારા દ્વારા સમયાંતરે ધિરાણકર્તા પાસેથી મેળવેલી અન્ય કોઈપણ સુવિધાઓના સંદર્ભમાં પૂર્વાધિકાર અને માંડવાળનો અધિકાર હશે.

9. પરચુરણ

1. હું સમજું છું અને સંમત છું કે મારા દ્વારા આપવામાં આવતી કોઈપણ સૂચના અથવા વિનંતી લેખિતમાં હોવી જોઈએ. બધી સૂચનાઓ અથવા વિનંતીઓ તે પક્ષ દ્વારા યોગ્ય રીતે પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવશે જેમને તેઓ સંબોધવામાં આવે છે જો તેઓ નીચે ઉલ્લેખિત સરનામે અથવા સંમત થઈ શકે તેવા અન્ય સરનામે આપવામાં આવે તો: ધિરાણકર્તા માટે રજિસ્ટર્ડ ઓફિસ: કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ, 502, ટાવર - એ, પેનિન્સુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ - 400 013 મારા માટે: અરજી ફોર્મમાં જણાવ્યા મુજબ સરનામું.

2. હું સમજું છું અને સંમત છું કે ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો અથવા તેની અમલવારીથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત તમામ દાવાઓ અને વિવાદોનું સમાધાન મારા અને ધિરાણકર્તા દ્વારા પરસ્પર નિયુક્ત એક લવાઈ મારફતે મધ્યસ્થી દ્વારા કરવામાં આવશે. આર્બિટ્રેશનનું સ્થળ મુંબઈમાં હશે. લવાઈ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ, 1996 અથવા તેના કોઈપણ વૈધાનિક સુધારા અથવા પુનઃઅધિનિયમની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવશે અને આવા આર્બિટ્રેટરનો નિર્ણય અંતિમ અને ઉધાર લેનાર અને ધિરાણકર્તા બંને માટે બંધનકર્તા રહેશે.

3. હું સમજું છું અને સંમત છું કે મને ધિરાણકર્તા દ્વારા આપવામાં આવેલી કોઈપણ સુવિધા હેઠળ લેણાંની ચુકવણીમાં અથવા તેની તરફ ધિરાણકર્તા અથવા તેની કોઈપણ પેટાકંપની/આનુષંગિક/એસોસિએટ કંપનીના કબજામાં (પછી એકલ અથવા સંયુક્ત રીતે) ધિરાણકર્તા, અન્ય કોઈપણ કરારના પૂર્વગ્રહ વિના, તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, મારી પાસેની અન્ય કોઈપણ નાણાં, રકમ, સિક્યોરિટીઝ અને અન્ય મિલકતને લાગુ કરવાની સ્વતંત્રતા પર રહેશે.

4. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા મારા લેણાં વસૂલવા માટે મારા જોખમે અને ખર્ચ પર એક અથવા વધુ સંસ્થાઓ અથવા વ્યક્તિઓની નિમણૂક કરવા માટે હકદાર હશે અને ધિરાણકર્તા યોગ્ય માની શકે તે રીતે મારા સંબંધિત વધુ માહિતી, હકીકતો અને આંકડાઓ શેર કરવા માટે પણ

હકદાર હશે. હું વધુમાં સંમત છું કે આ સંદર્ભે ધિરાણકર્તા અથવા ધિરાણકર્તા દ્વારા નિયુક્ત કોઈપણ તૃતીય પક્ષ મને ટેલીફોન અથવા અસંમત અથવા ઈમેલ દ્વારા અથવા અન્ય કોઈપણ યોગ્ય ડિજિટલ કોમ્યુનિકેશનના સ્વરૂપ દ્વારા અથવા રહેઠાણ/વ્યવસાયના સ્થળે ભૌતિક મુલાકાત દ્વારા અને બાકી રકમની વસૂલાત માટે કોઈપણ ટેલી ફોન અથવા વ્યક્તિગત મુલાકાત દ્વારા બાકી રકમની ચુકવણીના સંદર્ભમાં યાદ અપાવી શકે છે અને બાકી રકમની વસૂલાત માટે કોઈ પણ ટેલી ફોન અથવા વ્યક્તિગત મુલાકાત મને સવારે 8 થી સાંજના 7 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે અને આ સંબંધમાં CGCL દ્વારા કરવામાં આવેલા સંદેશાવ્યવહાર/રિમાઇન્ડર્સના આવા વધારાના મોડેલ CGCL ના ભાગ પર ફરજિયાત હોવાનું માનવામાં આવતું નથી અને તે ફક્ત CGCLની વિવેકબુદ્ધિ પર જ કરવામાં આવશે. હું સમજું છું અને સંમત છું કે હું આ ફોર્મમાં વિગતવાર દર્શાવ્યા મુજબ CGCLને ઉપલબ્ધ આધાર માટે આગળ વધતા પહેલા CGCL દ્વારા કરવામાં આવનારા આવા વધારાના સંદેશાવ્યવહાર પર ભાર મૂકવા માટે હકદાર નથી, જેમાં હરાજી હાથ ધરવા, માંડવાળ વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ આટલા સુધી મર્યાદિત નથી.

5. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા, કોઈપણ સમયે, વ્યવહાર દસ્તાવેજો હેઠળ તેના તમામ અથવા કોઈપણ અધિકારો, લાભો અને જવાબદારીઓને સોંપી અથવા ટ્રાન્સફર કરી શકે છે.

6. હું તે સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા તેના સહ-ધિરાણ કર હેઠળ સહ ધિરાણ કરાર હેઠળ સંમત થઈ શકે છે તે સહિત, તેના ઋણ લેનારાઓ દ્વારા મેળવેલી સુવિધાઓ હેઠળ CGCLના આવા અધિકારો અને જવાબદારીઓને સોંપવા અથવા સ્થાનાંતરિત કરવા માટે અને 5 નવેમ્બર, 2020 ના FIDD.CO.Plan. BC.No.8/04.09.01/2020-21 ના સહ-ધિરાણ પરની RBIની માર્ગદર્શિકા અથવા અન્ય કોઈપણ સૂચનાઓ/પરિપત્ર/નિર્દેશો અનુસાર સહ-ધિરાણની વ્યવસ્થા કરી શકે છે, જે વખતો વખત સુધારી શકાય. હું સહ ધિરાણની આવી સહ-ધિરાણ વ્યવસ્થાને કારણે સુધારી શકાય તેવી તમામ શરતોનું પાલન કરવા સંમત છું અને બાંધધરી આપું છું.

7. હું સમજું છું અને સંમત છું કે તમામ વ્યવહારો માત્ર કામકાજના દિવસોમાં જ ધિરાણકર્તાના નિયમિત કામકાજના કલાકો દરમિયાન કરવામાં આવશે.

8. હું સમજું છું અને સંમત છું કે ધિરાણકર્તા આ પ્રમાણભૂત શરતોની શરતોને સંશોધિત કરવાનો અધિકાર અનામત રાખે છે, જેમાં મને સૂચિત કરવામાં આવી શકે તેવા કોઈપણ લાગુ કાયદામાં ફેર

9. હું સમજું છું અને સંમત છું કે પૂરી પાડવામાં આવેલ સુવિધાનો ઉપયોગ કરીને, હું અહીં સૂચિબદ્ધ નિયમો અને શરતોને બિનશરતી અને અનિવાર્યપણે સ્વીકારું છું અને સમયાંતરે સુધારો કરી શકીશ અને તેનું પાલન કરીશ અને દરેક સમયે બંધનકર્તા રહીશ.

10. ફાટકા: હું સમજું છું, સંમત છું અને આથી પુષ્ટિ કરું છું કે હું ભારતનો નાગરિક અને કાયમી નિવાસી છું અને ભારતના કર શાસનને આધિન છું.

11. ગીરો: સુવિધાને સુરક્ષિત કરવા માટે સોનાના દાગીના CGCL પાસે જમા કરાવવામાં આવ્યા છે અને ગીરવે મૂકેલી વસ્તુઓના માત્ર સોનાના ઘટકને મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે.

12. માર્જિન: ઋણ લેનારાઓએ ખાતરી કરવી જોઈએ કે દરેક સમયે બાકી રહેલ કુલ રકમ ગીરવે મૂકેલ વસ્તુઓના મૂલ્યના 75% અથવા ધિરાણકર્તા દ્વારા સમયાંતરે નિર્ધારિત અન્ય ટકાવારીથી વધુ ન હોય.

13. હરાજી: CGCL તેની નીતિ અનુસાર અને આ માનક શરતોના કલોઝ 7 માં આપેલ ડિફોલ્ટની કોઈપણ ઘટનાના સંજોગોમાં આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર ગીરવે મૂકેલ વસ્તુઓની હરાજી શરૂ કરી શકે છે.

14. ફરિયાદ નિવારણ અધિકારી: કોઈપણ સેવા સંબંધિત સમસ્યા અથવા દસ્તાવેજો પ્રાપ્ત કરવા સહિતની કોઈપણ ફરિયાદ અને દાદના સંજોગોમાં, ઋણ લેનારા લેખિતમાં, મૌખિક રીતે, ઈલેક્ટ્રોનિક રીતે ઈ-મેલ, વેબસાઈટ, ટેલિફોન દ્વારા અને નીચે આપેલ રીતે વાતચીત કરી શકે છે. ઉધાર લેનાર નીચેની કોઈપણ ચેનલો દ્વારા અમારી ઓફિસનો સંપર્ક કરી શકે છે: -

(A) અમારા કોલ સેન્ટર સાથે 1800-102-102-1 (ટોલ ફ્રી) પર સોમવારથી શુક્રવાર (જાહેર રજાઓ સિવાય) સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ટેલિફોનિક સંચાર દ્વારા.

(B) ઈ-મેલ દ્વારા: caregl@capriglobal.in;

(C) ગ્રાહક સેવાને લેખિત પત્ર સરનામા દ્વારા - ગોલ્ડ લોન, કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ, 502, ટાવર એ, પેનિન્સુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ 400013

(D) સેવા શાખાની શારીરિક મુલાકાત લઈને અને અમારી શાખાઓમાં જાળવવામાં આવેલ ફરિયાદ રજિસ્ટરમાં ફરિયાદ નોંધાવી.

(E) ઉધાર લેનાર ફરિયાદ નોડલ ઓફિસર શ્રી બિનીત પાલ (ઈ-મેઇલ: nodalofficer@capriglobal.in અથવા ફોન: ૦૨૨ ૪૧૭૮૮૭૩૮) ને આગળ વધારી શકે છે.

15. ગ્રાહક સેવાઓ

(A) ઋણ લેનારા સોમવારથી શુક્રવાર સુધી (જાહેર રજાઓ સિવાય) સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યાની મુલાકાતના કલાકો દરમિયાન સેવા શાખાની મુલાકાત લઈ શકે છે.

Signed by OTP ()



કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.



(B) ઋણ લેનારા અમારા કોલ સેન્ટરનો 1800-102-102-1 (ટોલ ફ્રી) પર સોમવારથી શુક્રવાર (જાહેર રજાઓ સિવાય) સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી સંપર્ક કરી શકે છે.

(C) ઋણ લેનાર ઈમેઇલ દ્વારા ગ્રાહક સેવા સુધી પહોંચી શકે છે: - carel@capriglobal.in.

10. સંપત્તિનું વર્ગીકરણ

12 નવેમ્બર, 2021 ના રોજ જારી કરાયેલ “આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ અને એડવાન્સિસ સંબંધિત જોગવાઈઓ - સ્પષ્ટીકરણ” પર ભારતીય રિઝર્વ બેંકની સૂચના મુજબ, હું, ઋણ લેનાર નીચેની લોન વર્ગીકરણ માળખાને નોંધીશ:

વર્ગીકરણ	DPD બકેટ રેન્જ	વર્ણન
SMA-0	30 સુધી દિવસો	જો લોન એકાઉન્ટની નિયત તારીખ 31 માર્ચ, 2021 છે, અને આ તારીખ માટે ડે-એન્ડ પ્રોસેસિંગ પહેલાં સંપૂર્ણ બાકી રકમ પ્રાપ્ત થઈ નથી, તો ઓવરડ્યુની તારીખ 31 માર્ચ, 2021 હશે, તેને SMA-0 તરીકે પ્રક્રિયા કરવામાં આવશે. 31 માર્ચ, 2021 ના રોજ તરીકે ટેગ કરવામાં આવશે.
SMA-1	30 દિવસથી વધુ અને 60 દિવસ સુધી	ઉપરથી આગળ વધીને, જો ખાતું ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહેશે, તો તેને SMA-1 તરીકે ટેગ કરવામાં આવશે જ્યારે ડે-એન્ડ પ્રક્રિયા 30 એપ્રિલ, 2021ના રોજ ચલાવવામાં આવશે, એટલે કે સતત ઓવરડ્યુ રહેવાના 30 દિવસ પૂર્ણ થવા પર.
SMA-2	60 દિવસથી વધુ અને 90 દિવસ સુધી	ઉપરથી આગળ વધીને, જો ખાતું ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહેશે, તો તેને SMA-2 તરીકે ટેગ કરવામાં આવશે જ્યારે ડે-એન્ડ પ્રક્રિયા 30 મે, 2021ના રોજ ચલાવવામાં આવશે, એટલે કે સતત ઓવરડ્યુ રહેવાના 60 દિવસ પૂર્ણ થવા પર.
નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)	90 દિવસથી વધુ	ઉપરથી આગળ વધીને, અને જો ખાતું આગળ ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહેશે, તો તે 29 જૂન, 2021 ના રોજ ડે-એન્ડ પ્રક્રિયા ચાલવા પર NPA તરીકે વર્ગીકૃત થશે. એકવાર એકાઉન્ટ NPA બની જાય એટલે કે, 90 દિવસ માટે ઓવરડ્યુ રહેવાનું ચાલુ રહે, તે તમામ ઓવરડ્યુ રકમ* અને તેની DPD 0 થઈ જાય ત્યાં સુધી તેને NPA તરીકે ટેગ કરવામાં આવશે. કરવામાં આવેલ કોઈપણ આંશિક ચૂકવણી એનપીએની સ્થિતિને બદલશે નહીં.

*ઓવરડ્યુ રકમ એ બાકી વ્યાજ અથવા મુદલ અથવા બંને પુનઃચૂકવણી શેડ્યૂલ મુજબ છે



કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.



GST ઘોષણા

રજિસ્ટર્ડ સંસ્થાનું નામ	GST નંબર	GST રજિસ્ટર્ડ સરનામું	રાજ્ય
NA	NA	NA	NA

હું / અમે ખાતે રહીએ છીએ આથી જાહેર કરી અને બાંધધરી આપીએ છીએ કે:

- હું/અમે જાહેર કરીએ છીએ અને સ્વીકારીએ છીએ કે મેં/અમે લોનની સુવિધા માટે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડનો સંપર્ક કર્યો છે અને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ મને/અમને લોન દસ્તાવેજમાં નિર્ધારિત નિયમો અને શરતો પર આ લોન આપવા માટે સંમત થઈ શકે છે.
- હું/અમે જાહેર કરીએ છીએ અને સ્વીકારીએ છીએ કે હું/અમે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 (હવે પછીથી 'GST એક્ટ' તરીકે ઓળખાય છે) અને /અથવા મને/અમે સમયાંતરે GST કાયદા હેઠળ સૂચિત કરવામાં આવે તે નિયમો અને નિયમનો હેઠળ નોંધાયેલા છીએ, અને હું/અમે સમયાંતરે મને/અમને લાગુ પડતા આવા કોઈપણ નિયમોનું પાલન કરીશું.
- હું/અમે ઘોષણા કરીએ છીએ અને જણાવીએ છીએ કે મેં/અમે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને આપેલી ઉપરોક્ત GST વિગતો સાચી અને ખરી છે અને મારી/અમારી GST સંબંધિત વિગતોમાં કોઈ ફેરફાર થાય તો હું/અમે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને જાણ કરવા અને અપડેટ કરવાનું બાંધધરી આપીએ છીએ.
- હું/અમે સંમત છીએ કે મારા/અમને કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ દ્વારા જણાવવામાં આવેલ GST સંબંધિત વિગતોમાં કોઈપણ ફેરફાર કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ દ્વારા આવી ફેરફારની વિનંતી પ્રાપ્ત થયાની તારીખથી સંભવિત અસરથી લાગુ કરવામાં આવશે.
- હું/અમે જાહેર કરીએ છીએ અને જણાવીએ છીએ કે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ દ્વારા અને જ્યારે જરૂર પડે ત્યારે હું/અમે GST કાયદા હેઠળ નોંધાયેલ હોવાના સંજોગોમાં, હું/અમે GST નંબર અને અન્ય GST સંબંધિત વિગતોના પુરાવા સબમિટ કરીશું.
- હું/અમે સ્વીકારીએ છીએ અને સંમત છીએ કે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ મારા/અમારા દ્વારા કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને આપેલી ખોટી/અચોક્કસ/અપૂર્ણ માહિતીને કારણે GST કેડિટની કોઈપણ બિન-પ્રાપ્તિ/ટૂંકી પ્રાપ્તિ માટે જવાબદાર રહેશે નહીં.
- કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ વસૂલવામાં આવેલા ચાર્જના સંબંધમાં કેડિટ નોટ ઇશ્યુ કરે તેવા સંજોગોમાં, હું/અમે મેળવેલ GST ઇનપુટ ટેક્સ કેડિટ, જો કોઈ હોય તો, જે મહિનામાં વિસંગતતાની જાણ કરવામાં આવી હોય તેની અંદર ઉલટાવીશું. જો કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ પર ઉદ્ભવતી કોઈપણ વધારાની જવાબદારી (પછી ભલે તે કર, વ્યાજ, દંડ અથવા અન્ય સ્વરૂપમાં હોય) માં પરિણમે તે (કોઈપણ કારણોસર) સુધારવામાં ન આવે તો, હું/અમે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને આવી રકમ તાત્કાલિક ચૂકવીશું અને/અથવા ભરપાઈ કરીશું.
- હું/અમે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડને જરૂરી GST સંબંધિત માહિતી પૂરી પાડતા ન હોય તે સંજોગોમાં, કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ અમને 'અનનોંધાયેલ' ગણી શકે છે અને તે મુજબ આગળ વધી શકે છે.
- લોન દસ્તાવેજોમાં 'સર્વિસ ટેક્સ', 'વેલ્યુ એડેડ ટેક્સ' અથવા 'વેટ' શબ્દોનો કોઈપણ સંદર્ભ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) તરીકે વાંચવામાં આવશે અને તે મુજબ લાગુ દર મુજબ કર વસૂલવામાં આવશે.
- હું/અમે એ વાતથી વાકેફ છીએ કે અમારા ઉપરોક્ત ઉપક્રમોના વિશ્વાસ પર કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ ઉક્ત લોનનું વિતરણ કરી શકે છે અથવા આવી સુવિધા ચાલુ રાખી શકે છે.

Signed by OTP ()



કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.
રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.

CAPRI
LOANS



સોનાના ઝવેરાતની માલિકીની જાહેરાત અને ચકાસણી*

આ ઘોષણા ગીરવે મુકેલા ઝવેરાતની માલિકીની પુષ્ટિ અને ચકાસણી માટે લોન નંબર સામે - પાસેથી મેળવવામાં આવી રહી છે.

મારા દ્વારા આપવામાં આવેલ સોનું જાતે ખરીદેલું છે

ધરેણાની વિગત	આઈટમની ગણતરી	ઇમેજ	કુલ વજન(ગ્રામ)
--------------	--------------	------	----------------

Capri Loans App par sab **spasht aur saral**



SCAN TO
DOWNLOAD



Maujuda Loan pe
Top up ki sahuliyat



Aasaan byaaj
ka bhugtaan



Payeein sampoorana
loan details



Seva Anurodh
ki suvidha



કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ.

રજી. ઓફિસ: 502, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ,
મુંબઈ - ઇમેઇલ: caregl@capriglobal.in / ટોલ ફ્રી નંબર: 1800-102-102-1.



ધ્યાન આપો!

ફક્ત સત્તાવાર ચુકવણી માધ્યમોનો ઉપયોગ કરો

પ્રિય ગ્રાહકો,

આ એક નમ્ર પરંતુ અત્યંત મહત્વપૂર્ણ સૂચના છે કે કૃપા કરીને કોઈપણ પરિસ્થિતિમાં Capri Loans ના કોઈપણ કર્મચારીના વ્યક્તિગત બેંક ખાતામાં ચૂકવણી ન કરો, તેમજ લોનની ચુકવણી માટે કોઈપણ કર્મચારીને શાખાની નક્કી કરેલ કેશ કાઉન્ટરના બહાર કેશ રકમ હસ્તાંતરિત ન કરો।

કૃપા કરીને માત્ર નીચે જણાવેલા Capri Loans ના અધિકૃત ચુકવણી વિકલ્પોનો જ ઉપયોગ કરો:

1. Capri Loans ની વેબસાઈટ પર ઉપલબ્ધ PayNow લિંક
2. Capri Grahak મોબાઇલ એપ્લિકેશન
3. BBPS સક્ષમ પ્લેટફોર્મ જેમ કે PhonePe, Google Pay, Paytm વગેરે
4. શાખામાંથી જનરેટ થયેલ ઇ-ઇન્વોઇસ દ્વારા E-Collect વર્ચ્યુઅલ એકાઉન્ટ
5. શાખાના કેશ કાઉન્ટર પર ₹19,999 સુધીની રોકડ ચુકવણી (કૃપા કરીને સિસ્ટમ જનરેટ થયેલી રસીદ માંગવી)

Capri Loans કોઈપણ કર્મચારીને સીધી ચુકવણી સ્વીકારવા માટે અધિકૃત નથી. આવા કોઈપણ યોગદાન માટે સંપૂર્ણ જવાબદારી ગ્રાહકની રહેશે અને Capri Loans એ માટે જવાબદાર ન રહેશે.

તમારા સહયોગ અને સતત વિશ્વાસ માટે ખુબ આભાર.

સાદર,

ટીમ Capri Loans

